

# જતન અને તક લક્ષી આયોજન



## ઓન્ટેરિઓ બજેટ 2018: ટોચની 10 વિશિષ્ટતાઓ

પ્રાંતની આ યોજનામાં સ્વાસ્થ્યનું જતન, બાળ સંભાળ, ગૃહ સુધારણા અને માનસિક સ્વાસ્થ્ય લક્ષી નોંધપાત્ર નવા રોકાણો તથા પ્રાંતના લોકો માટે વધુ તકો ઊભી કરવાના નવા પગલાં સામેલ છે. તે નીચેની વિશિષ્ટતાઓ ધરાવે છે:



1. ઓહિપ+ કાર્ડ મારફત 65 વર્ષ અને તેની ઉપરના દરેક માટે મફત પ્રિસ્ક્રિપ્શન દવાઓ કોઈ વરિષ્ઠ નાગરિકને ક્યારેય જરૂરી દવાઓ વગર રહેવું ન પડે તેની ખાતરી કરવા 65 વર્ષ અને તેનાથી વધુ ઉંમરનાઓ માટે પ્રિસ્ક્રિપ્શન દવાઓ સંપૂર્ણપણે મફત કરી રહ્યા છીએ. ઓન્ટેરિઓ ડ્રગ બેનિફિટની વાર્ષિક કપાતો અને સહ-ચુકવણી નિર્મૂળ કરવાથી, તે ઓન્ટેરિઓના હરેક વરિષ્ઠ દીઠ દર વર્ષે સરેરાશ 240 ડોલરની બચત કરે છે. ઓહિપ+ નું આ વિસ્તરણ 2017 ના ઓન્ટેરિઓના અંદાજપત્રમાં 25 વર્ષથી ઓછી ઉંમરના દરેક માટે મફત પ્રિસ્ક્રિપ્શનો વિષે કરેલી રજૂઆતને અનુસરે છે.



### 2. વધુ બાળ સંભાળ, વધુ પસંદગીઓ

કિન્ડરગાર્ટનમાં જવાલાયક થાય ત્યાં સુધી અઢી વર્ષના બાળકો માટે મફત શાળાપૂર્વ જોગવાઈ રજૂ કરી પરવડી શકે તેવી વધુ ગુણવત્તાયુક્ત બાળ સંભાળ પૂરી પાડી રહ્યા છીએ. આ જોગવાઈ એક બાળકવાળા કુટુંબ માટે 17,000 ડોલર, સરેરાશ રીતે, બચાવે છે, જે પૂર્ણ દિવસના કિન્ડરગાર્ટનથી પરિવારોને મળતી બચતમાં વધારો કરે છે. બાળકોની જીવનપર્યંતની શૈક્ષણિક કારકિર્દીમાં સુધારો લાવવા પૂર્વપ્રારંભિક શિક્ષણને વાસ્તવદર્શી માનવામાં આવ્યું છે.



### 3. ન્યૂ ઓન્ટેરિઓ ડ્રગ એન્ડ ડેન્ટલ પ્રોગ્રામ

જેઓને કાર્યસ્થળે સ્વાસ્થ્યલક્ષી લાભો મળતા નથી અથવા જેઓ OHIP + કે અન્ય સરકારી કાર્યક્રમો દ્વારા આવરી લેવામાં ન આવ્યા હોય તેમને માટે એક નવો ઓન્ટેરિઓ ડ્રગ એન્ડ ડેન્ટલ પ્રોગ્રામ દાખલ કરી રહ્યા છીએ, જેમાં, હકયોગ્ય પ્રિસ્ક્રિપ્શન દવાઓ અને દાંતની સારસંભાળના ખર્ચ પર દર વર્ષે 80 ટકા જેટલું - એકદોકલ વ્યક્તિ દીઠ મહત્તમ 400 ડોલર, દંપતિ દીઠ 600 ડોલર અને બે બાળકો વાળા ચાર જણાના પરિવાર માટે 700 ડોલર સુધી - વળતર આપી રહ્યા છીએ.



#### 4. સિનિયર્સ હેલ્થી હોમ પ્રોગ્રામ

નવો સિનિયર્સ હેલ્થી હોમ પ્રોગ્રામ દાખલ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમ વૃદ્ધો જ્યાં રહેવા માંગતા હોય ત્યાંનાં, ઘરે રહેતા વરિષ્ઠો સાથે સંકળાયેલા ખર્ચાઓને માન્યતા આપે છે. તેમને સ્વતંત્ર રીતે રહેવામાં મદદ કરવા અને તેમના ઘરોને જાળવવાના ખર્ચને સરભર કરવા 75 કે તેથી વધુ વયના વરિષ્ઠોની અગ્રીમતા હેઠળના પાત્રતા ધરાવતા પરિવારો માટે આ કાર્યક્રમ દર વર્ષે 750 ડોલરનો લાભ આપે છે



#### 5. સુસજ્જ હોસ્પિટલો, બહેતર સેવા

2018-19માં વધારાના 822-મિલિયન ડોલરના રોકાણ, તેમજ આવતા 10 વર્ષના ગાળામાં હોસ્પિટલો બાંધવા અને જીર્ણોદ્ધાર કરવા માટે લગભગ 19 બિલિયન ડોલરના રોકાણ દ્વારા આરોગ્યસેવા સાનુકુળ કરવા, પ્રતીક્ષાગાળો ઘટાડવા, ક્ષમતાની સમસ્યાઓ હાથ ધરવા અને ઓન્ટેરિઓની વધતી જતી અને વૃદ્ધ વસતીની જરૂરિયાતો પૂરી કરવા હોસ્પિટલ સેવાઓ સુધારી રહ્યા છીએ.



#### 6. માનસિક સ્વાસ્થ્ય મહત્વનું છે

આવતા ચાર વર્ષોમાં કુલ 17 બિલિયન ડોલરથી વધુ ભંડોળ ફાળવી - પુરા ઓન્ટેરિઓમાં હજારો વધુ બાળકો, યુવાનો અને પુખ્ત વયના લોકો માટે માનસિક સ્વાસ્થ્ય અને વ્યસનમુક્તિને લગતી સેવાઓની બહેતર અને ઝડપી પ્રાપ્યતા પૂરી પાડી રહ્યા છીએ.




#### 7. વરિષ્ઠો માટે ગૃહ સંભાળ

આવતા ત્રણ વર્ષોમાં 650 મિલિયન ડોલરના રોકાણ દ્વારા, અંગત સહાયસેવાના 2.8 મિલિયન વધુ કલાકો અને 284,000 વધુ નર્સિંગ મુલાકાતો સમાવતી, હોમ અને કમ્યુનિટી હેલ્થ કેર સેવાઓની વધુ સાનુકુળતા પૂરી પાડી રહ્યા છીએ.



#### 8. વિકસીતાવસ્થામાં અસમર્થ વ્યક્તિઓને લગતા અંતરાયો દૂર કરી રહ્યા છીએ

એક અભિગમ કે જેના વડે ડિજિટલ વિકલ્પો સહીત સમાજમાં સક્રિય ભાગીદારી માટે સક્ષમ બનાવવા 47,000 જેટલા વિકસીતાવસ્થામાં અસમર્થ વ્યક્તિઓની સેવાઓ દૃઢ કરવા 1.8 બિલિયન ડોલરનું રોકાણ કરી એક ન્યાયી સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ.



- 9. મફત ટ્યુશનથી વિદ્યાર્થીઓની સફળતા માટે આધાર પૂરો પાડી રહ્યા છીએ**  
તમામ ઉંમરના 225,000 થી વધુ વિદ્યાર્થીઓ માટે કોલેજ અને યુનિવર્સિટી ટ્યુશન મફત કરી રહ્યા છીએ. નિમ્ન અને મધ્યમ આવકવાળા પરિવારોના વિદ્યાર્થીઓ માટે મફત અથવા ઓછી ટ્યુશન ફી ઉપલબ્ધ છે; 9,000 ડોલર સુધીની આવકવાળા માટે ટ્યુશન મફત છે અને 175,000 ડોલર સુધીની આવકવાળા પરિવારોના વિદ્યાર્થીઓ પણ નાણાકીય સહાયપાત્ર છે.



- 10. લઘુત્તમ વેતન વધારી રહ્યા છીએ અને સારી નોકરીઓ ઉભી કરી રહ્યા છીએ**  
જાન્યુઆરી 1, 2018 ના રોજ ન્યૂનતમ વેતન 14 ડોલર પ્રતિ કલાક વધારીને જાન્યુઆરી 1, 2019 થી 15 ડોલર પ્રતિ કલાક કરી પુરા ઓન્ટેરિઓમાં 1.2 મિલિયન લોકો માટે લાંબા સમયથી રાહ જોવાતો પગાર વધારો આપી રહ્યા છીએ. ઓન્ટેરિઓના વ્યવસાયો, વિદ્યાર્થીઓ અને સ્નાતકોને ટેકો પૂરો પાડવા, અને સારી, સારા પગારવાળી નોકરીઓ આકર્ષવામાં મદદ કરવા ગુડ જોબ્સ એન્ડ ગ્રોથ પ્લાન દ્વારા પ્રાંત આવતા ત્રણ વર્ષમાં નવા ભંડોળ રૂપે 935 મિલિયન ડોલર પણ આપી રહ્યો છે.